

પ્રોએક્ટીવ ડીસ્કલોગ્ર

કચેરીનું નામ:- કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી

મુદ્દા નંબર :- ૧ પોતાના વ્યવસ્થાતંત્ર કાર્યો અને ફરજોની વિગત :-

પરિચય

કૃષિ વિજ્ઞાન કેન્દ્રએ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હી તરફથી પ્રાપ્ય ૧૦૦ % ગ્રાન્ટથી ચાલતી "ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી" માટેની વિસ્તરણ શિક્ષણ યોજના છે. ભારત સરકારે દેશના તમામ રાજ્યોના પ્રત્યેક જિલ્લામાં એક કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના કરવાનું નક્કી કરેલ છે, તે મુજબ હાલ ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં એક-એક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મંજૂર કરવામાં આવેલ છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રનું કાર્યક્ષેત્ર જે તે જિલ્લો હોય છે. કેન્દ્ર હેઠળ ચાલતી પ્રવૃત્તિઓ ઘનિષ્ઠતાથી હાથ ધરી શકાય તે માટે જે તે જિલ્લાના ગામોના જૂથ નક્કી કરીને ખેડૂતોને કૃષિ, બાળાયત, પાક સંરક્ષણ, પશુપાલન, મરધાંઉંધેર, મત્સ્યપાલન, ગૃહવિજ્ઞાન વગેરેની નવીન ટેકનોલોજીથી વાકેફ કરવા માટે કેન્દ્ર બહાર તથા કેન્દ્ર પર એક/ચાર દિવસીય તાલીમ વર્ગો, તથા કૃષિ વિસ્તરણ પ્રવર્ત્તિઓના આયોજન કરવામાં આવે છે.

| | | | |
|---------------------------------|---|---|------|
| ૧. સ્થાપનાનું વર્ષ | : | ૧. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી | ૨૦૦૬ |
| ૨. યોજનાનો પ્રકાર | : | ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હી (ભારત સરકાર)ની ૧૦૦ % ગ્રાન્ટથી ચાલતી "ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી" માટેની વિસ્તરણ શિક્ષણ યોજના છે. | |
| ૩. હેતુઓ/ ઉદ્દેશો (Mandates) | : | <p>૧. ખેડૂતો અને ગ્રામીણ યુવાનો માટે "કાર્ય દ્વારા શિક્ષણ" પર ભાર મુકીને કૃષિ અને સંલગ્ન વિષયો અંગે ટૂકાં તેમજ લાંબા ગાળાના વ્યાવસાયિક તાલીમવર્ગો યોજીને સ્વરોજગારી વધારવાનો પ્રયત્ન કરવો.</p> <p>૨. નવીન કૃષિ તજશતાઓ અંગે ખેડૂતોના પ્રતિભાવો જાણવા માટે ખેડૂતોના ખેતરો ઉપર વિવિધ પાકોના પ્રથમ હરોળના નિદર્શનો (Front line demonstrations) યોજવા.</p> <p>૩. સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ ટકાઉ ખેતી પદ્ધતિઓ વિકસાવવા માટે નવી બહાર પાડવામાં આવતી કૃષિ તજશતાઓની જુદી જુદી કૃષિ-આબોહવાકીય પરિસ્થિતિમાં પોગ્યતા અને અનુકૂળતા ચકાસવા માટે તથા ખેડૂતોને તે પ્રત્યક્ષ બતાવવા માટે ખેડૂતોના ખેતરો પર ક્ષેત્રિય-અભતરા(On-farm trials)નું આયોજન કરવું.</p> <p>૪. કૃષિ અને સંલગ્ન વિષયોના સંશોધનો સબંધી અધ્યતન માહિતી અંગે જે તે કાર્યક્ષેત્ર વિસ્તારના વિસ્તરણ કાર્યકરો/અધિકારીઓને જાણકારી આપીને નવીન તજશતા અંગોના શાનમાં વધારો કરવા માટે નિયમિત રીતે તાલીમ કાર્યક્રમો યોજવા.</p> <p>૫. જીલ્લાનું કૃષિ સંલગ્ન શાન કેન્દ્ર (Knowledge Resources Centre) તરીકે વિકસાવવું.</p> | |
| ૪. કામગીરી | : | <p>કૃષિ વિજ્ઞાન કેન્દ્રનું કાર્યક્ષેત્ર જે તે જિલ્લો હોય છે. કેન્દ્ર હેઠળ ચાલતી પ્રવૃત્તિઓ ઘનિષ્ઠતાથી હાથ ધરી શકાય તે માટે જે તે જિલ્લાના ગામોના જૂથ નક્કી કરીને ખેડૂતોને કૃષિ, પશુપાલન, મરધાંઉંધેર, મત્સ્યપાલન, ગૃહવિજ્ઞાન વગેરેની નવીન ટેકનોલોજીથી વાકેફ કરવા માટે કેન્દ્ર બહાર તથા કેન્દ્ર પર એક અથવા ચાર દિવસીય તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવે છે.</p> <p>કૃષિ તાંત્રિકીનો અસરકારક પ્રચાર અને પ્રસાર કરવા તેમજ કાર્યક્ષેત્ર હેઠળના ખેડૂતો સાથે સતત સંપર્ક જાળવી રાખવા માટે કેન્દ્ર દ્વારા ખેડૂતદિન, ખેડૂતશિબિર, ફીલ્ડટ્રીપ, પદ્ધતિ નિદર્શનો, કૃષિપ્રદર્શન, કૃષિમેળો, ફિલ્મશો વગેરે વિસ્તરણ પ્રવૃત્તિઓનું સમયાંતરે આયોજન કરવામાં આવે છે.</p> | |

| | | |
|--|--|--|
| | | <p>ખેડૂતોના ખેતરે અગ્રીમ હરોળ નિર્દર્શનો ગોઠવી નવી તાંત્રીકતાઓ ખેડૂતોના ખેતરે સુધી પહોંચાડવામાં આવે છે.</p> <p>સંલગ્ન વિભાગોનાં તાંત્રિક મહેકમને આધુનિક સંશોધનથી માહિતગાર કરવા તેઓને માટે ખાસ રીક્ઝેશર તાલીમો આપવામાં આવે છે.</p> <p>કૃષિ સંલગ્ન વ્યવસાયને લગતી વ્યવસાયિક તાલીમો આપવામાં આવે છે.</p> |
|--|--|--|

મુદ્દા નંબર :— ૨ પોતાના અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો :—

(૧) ડા. સી. કે. ટીબડીયા, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા (K-1)

| | |
|---|---|
| ૧ | હેડ ઓફ યુનિટ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તથા હિસાબી વહીવટી કામગીરીની તમામ ટેખરેખ તથા તાંત્રિક માર્ગદર્શન અને નિયંત્રણ. |
| ૨ | શિક્ષણ અને વિસ્તરણની કેન્દ્ર ખાતેની યોજનાઓનું આયોજન અને અમલની કામગીરી. |
| ૩ | યુનિવર્સિટી કક્ષાની તથા મા.સરકારશ્રીની વખતો વખતની બેઠકોમાં હાજરી આપવી. |
| ૪ | યુનિ.અધિકારી તરીકે બધી યોજના(આયોજીત, બીનઆયોજીત, અન્ય)ની જવાબદારી નિભાવવી. |
| ૫ | ડાયરેક્ટર ATARI, મા.કુલપતિશ્રી, તથા મા.વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી સાથે પત્ર વ્યવહાર તથા રીપોર્ટિંગની કામગીરી |
| ૬ | કોન્ટ્રાક્ચ્યુઅલ સ્ટાફ મનિષાબેન અને વર્ષાબેન મુખ્ય સહાયક તરીકે રહેશે. જરૂર પડ્યે અન્ય કોઈપણ કોન્ટ્રાક્ચ્યુઅલ સ્ટાફ ની મદદ લેવી. |

(૨) ડા. સુમિત આર. સાણુંખે, વૈજ્ઞાનિક (વિસ્તરણ શિક્ષણ) (K-1-1)

| | |
|----|---|
| ૧ | વિસ્તરણ શિક્ષણ અંતર્ગત તાલીમ કાર્યક્રમોનું આયોજન, સંકલન અને અમલીકરણ તથા તત્સંબંધી ફાઈલો/ રેકર્ડની જાળવણી. |
| ૨ | કેવિકે સંબંધિત કાર્યવાહીનું તથા આઈ.સી.આર.ની કામગીરીનું રીપોર્ટિંગ તૈયાર કરવું |
| ૩ | ZREAC, AGRESCO, APR, QPR & MPR સંબંધિત રીપોર્ટિંગની કામગીરી K-6 સાથે કરવી. |
| ૪ | ખેડૂતોપણો ક્ષેત્રિય કાર્યક્રમો જેવા કે ફાર્મ મુલાકાત, ફિલ્ટરીંપ, ખેડૂત શિબીર, શૈક્ષણિક પ્રવાસ, ક્ષેત્રાદ્ધિન, કૃષિ પ્રદર્શન, કૃષિમેળો વિ.માં ખેતી અને સંલગ્ન પ્રવૃત્તિઓની નવીનતમ ટેકનોલોજીનો પ્રચાર અને પ્રસાર કરવો. |
| ૫ | વિષયને લગતી સફળ વાર્તા/કેસ સ્ટરી તૈયાર કરીને યોગ્ય જગ્યા અને સમયે તેની લેખિત તથા મૌખિક રજૂઆત કરવી. |
| ૬ | વિસ્તરણ શિક્ષણને લાગતી તમામ ફાઈલો નિભાવવાની કામગીરી |
| ૭ | રિવોલ્વીંગ ફંડમાં આવક વધે તેવી ફાર્મલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન, સંકલન અને તે સંબંધી કામગીરી. |
| ૮ | કેવિકે અને અન્ય યોજના ના એન્યુઅલ રિપોર્ટની કામગીરી K-6 સાથે કરવી. |
| ૯ | વિસ્તરણ શિક્ષણ વિષયક તાલીમ કાર્યક્રમોનું આયોજન, સંકલન અને અમલીકરણ તથા તત્સંબંધી ફાઈલો/રેકર્ડની જાળવણી. |
| ૧૦ | સેમિનાર/વર્કશૉપ/પરિસંવાદ/કોન્ફરન્સ/વ્યાખ્યાન/તાંત્રિક ચુપ મિટીંગ વિ.નું આયોજન, સંકલન, અમલ અને પત્રવ્યવહાર. |
| ૧૧ | વિસ્તરણ શિક્ષણ પરિષદ તથા નિયામક મંડળની બેઠક માટે જરૂરી તાંત્રિક માહિતી અને મુદ્દાનોંધ તૈયાર કરવી. |
| ૧૨ | ATMA પ્રોજેક્ટ સંબંધી પત્રવ્યવહાર અને ફાઈલો નિભાવવાની કામગીરી. |
| ૧૩ | કેવિકેની રીકર્િંગ/નોન રીકર્િંગ કન્ટીજન્સી અન્યથે કન્ઝ્યુમેબલ/ડિડસ્ટોક ચીજવસ્તુઓની ખરીદી, એબસ્ટ્રેક્ટ ઉપાડવું, ખરીદીની મંજૂરી, હિસાબ/ બીલો રજૂ કરવા તથા તત્સંબંધી પત્રવ્યવહાર/ રજિસ્ટરો/ ફાઈલોની નિભાવણી અને જાળવણી કે-૨ ટેબલ સાથે કરવી. |
| ૧૪ | કૃષિ વિજ્ઞાન કેન્દ્રના તમામ બજેટ સદરની ગ્રાન્ટની દરખાસ્ત ડીમાન્ડ ઓફ ફંડ, ઓડિટ યુટિલાઈઝેશન સર્ટિફિકેટ વિ. અંગે ADM ને માર્ગદર્શન આપવું તથા સમયસર કામગીરી થાય તે જોવું. |
| ૧૫ | અગત્યના કાર્યક્રમોનું સંચાલન કરવું તથા અન્ય સ્ટાફશાળા પાસે સંચાલન કરાવવું |
| ૧૬ | વૈજ્ઞાનિક સલાહકાર સમિતી(SAC)ની બેઠકનું આયોજન, મુદ્દાનોંધ, કાર્યનોંધ વિ. તમામ કામગીરી |
| ૧૭ | ગ્રામીણ કોન્ટેક્ટ જીવંત રાખવા અને નવીનતા લાવવી. |

| | |
|--|--|
| ૧૮ | કેવિકેના કાર્યક્રોનાં ગામોમાંથી લીડરોની ઓળખ કરી સમયાંતરે બેઠક બોલાવી આયોજન અને અમલીકરણમાં સામેલ કરવા. કેવિકેની તમામ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવું અને માનવબળનો પુરેપુરો ઉપયોગ કરવો/ કરાવવો. |
| ૧૯ | કેવિકે પર શિસ્તતાનું વાતાવરણ ઉભુ કરવું તેમજ સ્ટાફનાનાં આંતરિક પ્રશ્નો જાણી કેન્દ્રનાં વડાને ધ્યાને લાવવા. |
| ૨૦ | દરેક સ્ટાફની કામગીરીમા ફોલોઅપમાં જરૂરી માર્ગદર્શન આપવું. જેમાં વર્ષા પરમાર ની મદદ લેવી. |
| ૨૨ | કેન્દ્રના રીપોર્ટિંગમાં જરૂર પડે ત્યારે વિષયને લગતા ફોટોગ્રાફિસ પસંદ કરી સંબંધિતોને પહોંચાડવા. |
| ૨૩ | કેન્દ્ર તથા યુનિટના વડા વખતોવખત સોંપે તે કામગીરી કરવી. |
| ૨૪ | કોન્ટ્રાક્ચ્યુઅલ સ્ટાફ મધુરીબેન મુખ્ય સહાયક તરીકે રહેશે. જરૂર પડ્યે અન્ય કોઈપણ કોન્ટ્રાક્ચ્યુઅલ સ્ટાફ ની મદદ લેવી. |
| ૨૫ | પસંદ કરેલ ગામોમાં PRA / Benchmark Survey / Need Assessment / Identification of Thrust area સંબંધી કામગીરી. |
| (૩) ડૉ. કિંજલકુમાર અરવિંદભાઈ શાહ, વૈજ્ઞાનિક (સસ્યવિશાન) (K-2) | |
| ૧ | એગ્રોનોમી વિષયક તાલીમ કાર્યક્રમોનું આયોજન, સંકલન અને અમલીકરણ તથા તત્સંબંધી ફાઈલો/ રેકર્ડની જાળવણી. |
| ૨ | કેવિકેના મેન્ડેટલક્ષી પ્રથમ હરોળ નિર્દર્શનો(FLD) અને ફાર્મ પરના અખતરાં(OFT) સંબંધી કામગીરી. આ માટે જરૂરી ઈનપુટસની ખરીદી અને વિતરણ સંબંધી પત્રવ્યવહાર/રજિસ્ટરો/ફાઈલોની જાળવણી. |
| ૩ | ZREAC અને AGRESCOમાં એગ્રોનોમી વિષયના પ્રથમ હરોળના નિર્દર્શનો(FLD) અને ફાર્મ પરના અખતરાં(OFT)નો તાંત્રિક કાર્યક્રમ મંજૂર કરાવવા તથા રિઝલ્ટના આંકડાની રજૂઆત કરવી. |
| ૪ | કેવિકે ફાર્મના અખતરાં, નિર્દર્શન પ્લોટ, ડેમોન્સ્ટ્રેશન યુનિટ તથા પાક કૌતૂકાલય તૈયાર કરવાની કામગીરી. |
| ૫ | કેવિકે ફાર્મના ફાર્મ મેનેજર તરીકેની સંપૂર્ણ જવાબદારી કે-૮ ટેબલ સાથે કરવી. |
| ૬ | કેવિકેની પાક યોજનાઓની મંજૂરીની કામગીરી. |
| ૭ | એગ્રોનોમી વિષયક નવી યોજનાઓની દરખાસ્ત અને મંજૂર થયેલી યોજનાના અમલીકરણની કામગીરી. |
| ૮ | કેવિકેની રીકર્િંગ/નોન રીકર્િંગ કન્ટીજન્સી અન્વયે કન્જયુમેબલ/ડેડસ્ટોક ચીજવસ્તુઓની ખરીદી, ખરીદીની મંજૂરી મેળવી સંબંધિત ટેબલને સોપવા તેમજ ખરીદીના છિસાબ/ બીલો રજૂ કરવા તથા તત્ત્વબંધી પત્રવ્યવહાર/રજિસ્ટરો/ફાઈલોની નિભાવણી અને જાળવણી જે તે ટેબલે કરવી. |
| ૯ | રિવોલ્વિંગ ફંડમાં આવક વધી તેવી ફાર્મલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન, સંકલન અને તે સંબંધી કામગીરી. |
| ૧૦ | વિષયને લગતી સફળ વાર્તા / કેસ સ્ટડી તૈયાર કરીને યોગ્ય જગ્યા અને સમયે તેની લેખિત તથા મૌખિક રજૂઆત કરવી. |
| ૧૧ | ફાર્મની સંપૂર્ણ જવાબદારી અને સર્જીવખેતી યોજનાના અમલીકરણમાં મદદ કરવી. |
| ૧૨ | Cropping Pattern & Crop Production |
| ૧૩ | લેબોરેટરીની જવાબદારી |
| ૧૪ | રીવોલ્વીંગ ફંડ વધારવાની જવાબદારી |
| ૧૫ | એગ્રોનોમી રીલેટેડ રેકોર્ડ નિભાવવા |
| ૧૬ | ખેડુતોના ખેતરે મુલાકાત તથા સીડ હથ, NFSM યોજનનું અમલીકરણ. |
| ૧૭ | કેન્દ્ર ખાતે ઉપલબ્ધ માનવબળનો ઉપયોગ કરવો |
| ૧૮ | કેન્દ્રના રીપોર્ટિંગમાં જરૂર પડે ત્યારે વિષયને લગતા ફોટોગ્રાફિસ પસંદ કરી સંબંધિતોને પહોંચાડવા. |
| ૧૯ | એડોપ્ટ્રીવ ટ્રાયલ યોજનાનું આયોજન અને અમલીકરણ કરવું. |
| ૨૦ | કોન્ટ્રાક્ચ્યુઅલ સ્ટાફ શ્રી ઓમ નાકરાણી અને કૌશિક વાદી મુખ્ય સહાયક તરીકે રહેશે. જરૂર પડ્યે અન્ય કોઈપણ કોન્ટ્રાક્ચ્યુઅલ સ્ટાફ ની મદદ લેવી. |
| ૨૧ | કેવિકે પર શિસ્તનું વાતાવરણ ઉભુ કરવું તેમજ સ્ટાફનાનાં આંતરિક પ્રશ્નો જાણી કેન્દ્રનાં વડાને ધ્યાને લાવવા |
| ૨૨ | દરેક સ્ટાફની કામગીરીમા ફોલોઅપમાં જરૂરી માર્ગદર્શન આપવું. |
| ૨૩ | કેન્દ્ર તથા યુનિટના વડા વખતો વખત સોંપે તે કામગીરી કરવી. |

(૪) શ્રી રાષ્ટ્રિકાંત ગુજર્ાત, વૈજ્ઞાનિક (બાગાયત) (K-3)

| | |
|----|--|
| ૧ | બાગાયત વિષયક તાલીમ કાર્યક્રમોનું આયોજન, સંકલન અને અમલીકરણ તથા સંબંધિત ફાઈલો/રેકર્ડની જાળવણી. |
| ૨ | બાગાયતી પાકોના પ્રથમ હરોળના નિર્દર્શનો(FLD) અને ફાર્મ પરના અખતરાં(OFT) સંબંધી કામગીરી. આ માટે જરૂરી ઈનપુટસની ખરીદી અને વિતરણ સંબંધી કામગીરીમાં કે-૨ ટેબલને મદદરૂપ થવું. |
| ૩ | ZREAC અને AGRESCOમાં બાગાયત વિષયના પ્રથમ હરોળના નિર્દર્શનો (FLD) અને ફાર્મ પરના અખતરાં(OFT)ના તાંત્રિક કાર્યક્રમ મંજૂર કરાવવા તથા રિઝલ્ટના આંકડાની રજૂઆત કરવી. |
| ૪ | ખેડૂતોપયોગી ક્ષેત્રિય કાર્યક્રમો જેવા કે ફાર્મ મુલાકાત, ફિલ્ડટ્રીપ, ખેડૂત શિખીર, શૈક્ષણિક પ્રવાસ, ક્ષેત્રાદ્ધિન, કૃષિ પ્રદર્શન, કૃષિમેળો વિ.અંગોના આયોજન, સંકલન તથા અમલીકરણની કામગીરી તથા તે સંબંધી પત્રવ્યવહાર/રજિસ્ટરો/ફાઈલોની નિભાવણી અને જાળવણી. |
| ૫ | વિષયને લગતી સફળ વાર્તા / કેસ સ્ટડી તૈયાર કરીને ઘોંધ જગ્યા અને સમયે તેની લેખિત તથા મૌખિક રજૂઆત કરવી. |
| ૬ | કેવિકે ફાર્મ પર શ્રીન હાઉસ ઉભા કરી તેને લગતી પ્રવૃત્તિઓનું સંચાલન કરવું. |
| ૭ | બાગાયત વિષયક નવી યોજનાની દરખાસ્ત અને મંજૂર થયેલી યોજનાની અમલવારીની કામગીરી. |
| ૮ | કેવિકે ફાર્મમાં ફળપાકો/શાકભાજી પાકોની નર્સરી કાર્યરત કરવી અને રિવોલ્વિંગ ફંડમાં આવક વધી તેવી બાગાયતલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન, સંકલન અને તે સંબંધી કામગીરી. |
| ૯ | કેવિકે ફાર્મમાં બાગાયતી પાકોના અખતરાં, નિર્દર્શન પ્લોટ તૈયાર કરવાની કામગીરી. |
| ૧૦ | કેવિકેના કાર્યમથક બ્યુટીફિલેશનની કામગીરી |
| ૧૧ | કેવિકેની ખરીદી માં કે-૨ સાથે સંકલન કરવું. |
| ૧૨ | ફાર્મ પ્લાનિંગ અને ફાર્મ ડેમોસ્ટ્રેશનમાં મદદ કરવી |
| ૧૩ | નિર્દર્શન ફાર્મ અને ખેડૂત / સમુદ્ધાયનો સંપર્ક રાખવો |
| ૧૪ | તાંત્રિક પ્રશ્નોના જવાબ કરવા. |
| ૧૫ | હોટીકલ્યરના નિર્દર્શનો ગોઠવવા |
| ૧૬ | સમગ્ર વર્ષ દરમ્યાન શાકભાજીના ધરુ તૈયાર કરવા. |
| ૧૭ | બાગાયતી પાકોનું ઉત્પાદન કેવિકે પર નિયમીત કરવું. કેવિકે ખાતે કિચન ગાર્ડનની સંપૂર્ણ જવાબદારી નિભાવવી અને માર્ગદર્શન આપવું. તથા કેન્દ્ર બહાર કિચન ગાર્ડન પ્રવૃત્તિઓ હાથ ધરવી. |
| ૧૮ | દરેક ક્ષેત્રિય-ડેટા અને ફોટોગ્રાફીનું ડોક્યુમેન્ટેશન. |
| ૧૯ | ઈનોવેટીવ ડેમોસ્ટ્રેશન કેવિકે ફાર્મ પર ગોઠવવા. |
| ૨૦ | કેવિકેનો રેપોર્ટ બીલ્ડપ કરવો. |
| ૨૧ | સફળવાર્તાઓ લખવી. |
| ૨૨ | કેવિકે કેમ્પસમાં લેન્ડ સ્કેપીંગ અને ગાર્ડનનું માર્ગદર્શન આપવું. |
| ૨૩ | રિવોલ્વિંગ ફંડ વધારવાની જવાબદારી. |
| ૨૪ | ખેડૂતોના ખેતરે નિયમીત મુલાકાત લેવી. |
| ૨૫ | નેટહાઉસ, વર્મિકન્સ્પોસ્ટ, શ્રીનહાઉસને કાર્યરત કરવા. |
| ૨૬ | રિપોર્ટીંગ માટે નિર્દર્શનના પરિણામો તૈયાર કરવા. |
| ૨૭ | કોન્ટ્રાક્ચ્યુઅલ સ્ટાફ શ્રી અજ્ય પટેલ અને મુખ્ય સહાયક તરીકે રહેશે. જરૂર પડયે અન્ય કોઈપણ કોન્ટ્રાક્ચ્યુઅલ સ્ટાફની મદદ લેવી. |
| ૨૮ | કેન્દ્રના રીપોર્ટીંગમાં જરૂર પડે ત્યારે વિષયને લગતી ફોટોગ્રાફસ પસંદ કરી સંબંધિતોને પહોંચાડવા. |
| ૨૯ | કેન્દ્ર તથા યુનિટના વડા વખતો વખત સોંપે તે કામગીરી કરવી. |

(4) શ્રી પ્રકાશ. પી. પટેલ, વૈજ્ઞાનિક (મત્સ્યપાવન) (K-4)

| | |
|----|---|
| ૧ | મત્સ્ય વિષયક તાલીમ કાર્યક્રમોનું આયોજન, સંકલન અને અમલીકરણ તથા તત્સંબંધી ફાઈલો/રેકર્ડની જાળવણી. |
| ૨ | મત્સ્ય ઉછેર ટેકનોલોજીના અગ્રીમ હરોળ નિર્દર્શનો(FLD) અને ફાર્મ પરના અખતરાં(OFT) સબંધી કામગીરી. આ માટે જરૂરી ઈનપુટસની ખરીદી અને વિતરણ સંબંધી કામગીરીમાં કે-૨ ટેબલને મદદરૂપ થવું. |
| ૩ | ZREAC અને AGRESCOમાં મત્સ્ય વિષયક પ્રથમ હરોળ નિર્દર્શનો (FLD) અને ફાર્મ પરના અખતરાં(OFT)ના તાંત્રિક કાર્યક્રમ મંજૂર કરાવવા તથા રિઝલ્ટના આંકડાની રજૂઆત કરવી. |
| ૪ | ખેડૂતોપણોંગી ક્ષેત્રિય કાર્યક્રમો જેવા કે ફાર્મ મુલાકાત, ફિલ્ડટ્રીપ, ખેડૂત શિખીર, શૈક્ષણિક પ્રવાસ, ક્ષેત્રાદ્ધિન, કૃષિ પ્રદર્શન, કૃષિમેળો વિ.માં મત્સ્ય ઉછેરની નવિનતમ ટેકનોલોજીનો પ્રચાર અને પ્રસાર કરવો. |
| ૫ | વિષયને લગતી સફળ વાર્તા / કેસ સ્ટડી તૈયાર કરીને યોગ્ય જગ્યા અને સમયે તેની લેખિત તથા મૌખિક રજૂઆત કરવી. |
| ૬ | કેવિકે ખાતે બનાવેલ મત્સ્ય નિર્દર્શન તળાવમાં વિવિધ ફીશ ડેમોન્સ્ટ્રેશન(Fish Demonstration) તૈયાર કરી મત્સ્યપાલકોને નવિનતમ ટેકનોલોજીથી માહિતગાર કરવા. |
| ૭ | મત્સ્ય વિષયક નવી યોજનાઓની દરખાસ્તની કામગીરી. |
| ૮ | એસ્ટાબિલશામેન્ટ ઓફ ડેમોન્સ્ટ્રેશન-કમ-ટ્રેઇનિંગ સેન્ટર ફોર ઈનલેન્ડ ફિશરીઝ(બ.કે.૧૨૮૪૩)ના કાર્યવાહક અધિકારી તરીકેની સંપૂર્ણ જવાબદારી. |
| ૯ | કેવિકે યોજનાનો એકશન પ્લાન તૈયાર કરવો. |
| ૧૦ | કેન્દ્ર ખાતે પ્રદર્શિત એકવેરીયમમાં ઓનામેન્ટલ ફીશની જાળવણી કરવી તથા તેમાં વિવિધતા લાવવી. |
| ૧૧ | પસંદ કરેલ ગામોમાં PRA / Benchmark Survey / Need Assessment / Identification of Thrust area સબંધી કામગીરી. |
| ૧૨ | હોસ્ટેલની સંપૂર્ણ જવાબદારી કે-૮ ટેબલ સાથે સંભાળવી. |
| ૧૩ | કેન્દ્રના તમામ જનરેટર અને એરકંડીશનની જાળવણી તથા વપરાશ અંગેની જવાબદારી સંભાળવી. |
| ૧૪ | લેન્ડલાઈન ટેલિફોનની જાળવણીની જવાબદારી. |
| ૧૫ | કોન્ટ્રાક્ચ્યુઅલ સ્ટાફ ભૂમિકા અને યશ મુખ્ય સહાયક તરીકે રહેશે. જરૂર પડ્યે અન્ય કોઈપણ કોન્ટ્રાક્ચ્યુઅલ સ્ટાફની મદદ લેવી. |
| ૧૬ | કેન્દ્રના રીપોર્ટિંગમાં જરૂર પડે ત્યારે વિષયને લગતા ફોટોગ્રાફસ પસંદ કરી સંખ્યિતોને પહોંચાડવા. |
| ૧૭ | કૃષિ વિજ્ઞાન કેન્દ્રના તમામ બજેટ સંદરની ગ્રાન્ટની દરખાસ્ત ડીમાન્ડ ઓફ ફંડ, ઓડિટ યુટિલાઈઝેશન સટિફીકેટ વિ. અંગે ADM ને માર્ગદર્શન આપવું તથા સમયસર કામગીરી થાય તે જોવું. |
| ૧૮ | કેન્દ્ર તથા યુનિટના વડા વખતોવખત સોંપે તે કામગીરી કરવી. |

(૬) ડૉ. પ્રભુ નાયકા, વૈજ્ઞાનિક (પાક સંરક્ષણ) (K-5)

| | |
|---|---|
| ૧ | પાક સંરક્ષણ વિષયક તાલીમ કાર્યક્રમોનું આયોજન, સંકલન અને અમલીકરણ તથા તત્સંબંધી ફાઈલો/રેકર્ડની જાળવણી કરવી. |
| ૨ | પાક સંરક્ષણ ટેકનોલોજીના અગ્રીમ હરોળ નિર્દર્શનો(FLD) અને ફાર્મ પરના અખતરાં(OFT) સબંધી કામગીરી. આ માટે જરૂરી ઈનપુટસની ખરીદી અને વિતરણ સંબંધી કામગીરીમાં કે-૨ ટેબલને મદદરૂપ થવું. |
| ૩ | ZREAC અને AGRESCOમાં પાક સંરક્ષણ વિષયક પ્રથમ હરોળના નિર્દર્શનો (FLD) અને ફાર્મ પરના અખતરાં(OFT)નો તાંત્રિક કાર્યક્રમ મંજૂર કરાવવો તથા રિઝલ્ટના આંકડાની રજૂઆત કરવી. |
| ૪ | યુનિવર્સિટી, સરકારી/સહકારી/સ્વેચ્છિક સંસ્થાઓ, જોનલ કો ઓર્ડિનેટર અને ICAR સાથે પત્રવ્યવહાર અને ફાઈલોની જાળવણી. |
| ૫ | કેવિકે ફાર્મમા પાક સંરક્ષણને લગતાં અખતરાં તેમજ ફાર્મ ખાતેના અન્યનિર્દર્શનો, પાક કોતુકાલયમાં જરૂરીયાત મુજબ પાક સંરક્ષણની કામગીરી તથા નિર્દર્શન પ્લોટ તથા પાક કોતુકાલય તૈયાર કરવાની કામગીરીમાં કે-૨ ટેબલને મદદરૂપ થવું. |
| ૬ | કૃષિ વિજ્ઞાન કેન્દ્રના માસિક / ત્રિમાસિક / વાર્ષિક અહેવાલ તૈયાર કરવા કે-૬ ને મદદરૂપ થવું તથા સમયાંતરે સંખ્યિતને મોકલવાની કામગીરી. |

| | |
|----|--|
| ૭ | ખેડૂતોના પ્રશ્નોનું સ્થળ પર જરૂરી અને અસરકારક નિરાકરણ લાવવા માટે નિદાન ટીમ (Diagnostic team)ના ટીમ લીડર તરીકે કામગીરી કરવી જેમાં ખેડૂતોની સમસ્યાને અનુરૂપ જે તે વિષયના નિષ્ણાંતો સાથે સ્થળ પર પહોંચીને ખેડૂતોને સંતોષ થાય તે રીતે પ્રશ્નોનું નિરાકરણ લાવવું. |
| ૮ | પાક સંરક્ષણ વિષયક નવી યોજનાઓની દરખાસ્તની કામગીરી. |
| ૯ | ખેડૂતોપયોગી ક્ષેત્રિય કાર્યક્રમો જેવા કે ફાર્મ મુલાકાત, ફિલ્ડટ્રીપ, ખેડૂત શિબીર, શૈક્ષણિક પ્રવાસ, ક્ષેત્રાદ્ધિન, કૃષિ પ્રદર્શન, કૃષિમેળો વિ.માં પાક સંરક્ષણની નવિનતમ ટેકનોલોજીનો પ્રચાર અને પ્રસાર કરવો. |
| ૧૦ | વિષયને લગતી સફળ વાર્તા / કેસ સ્ટડી તૈયાર કરીને યોગ્ય જગ્યા અને સમયે તેની લેખિત તથા મૌખિક રજૂઆત કરવી. |
| ૧૧ | શ્રેષ્ઠ કેવિકે એવોર્ડ, સરદાર પટેલ એવોર્ડ, અસ્પી એવોર્ડ, ITK એવોર્ડ, વિ.એવોર્ડ્સ સબંધી કામગીરી અને પત્રવ્યવહાર. |
| ૧૨ | કેન્દ્રની પ્રવૃત્તિઓ/કાર્યક્રમોની ફોટોગ્રાફી/વિડીયોગ્રાફી આનુસારિક કામગીરી અને તે સબંધી પત્રવ્યવહાર. ફોટોગ્રાફસનું આલ્બમ તૈયાર કરવું તથા વિડીયો સીડીની યોગ્ય જાળવણી કરવી. |
| ૧૩ | ગુજરાત સરકાર પુરસ્કૃત યોજના/સજીવખેતી યોજના અંતર્ગત સજીવ ખેતીનો વ્યાપ વધે તે માટે જરૂરી નિર્દર્શનો/તાલીમો/પ્રેરણા પ્રવાસ વગેરે આયોજન કરવું તેને સમયાંતરે તેના રીપોર્ટ બનાવવી જે તે સક્ષમ અધિકારીને રજૂ કરવા. |
| ૧૪ | કેન્દ્ર હસ્તકના તમામ વાહનોનો સંપૂર્ણ ચાર્જ, જેમાં વાહનોની ખરીદી, રજિસ્ટ્રેશન, સર્વિસ, મરામત, મંજૂરી, RCબુક/લોગબુક સહિત દસ્તાવેજોની જાળવણી, સમયસર વીમા/ટેક્ષ ભરવા વિ.અંગેની કામગીરી કરવી. |
| ૧૫ | e-KVK ની તમામ કામગીરી (SMS મોકલવા) |
| ૧૬ | Website અપડેટ કરવી. |
| ૧૭ | કે.૧.૧ને રીપોર્ટીંગમાં મદદ કરવી અને તમામ કાર્યક્રમોની અંગેજી પ્રેસનોટ તૈયાર કરી પ્રકાશનમાં આપવી તથા અગત્યના કાર્યક્રમોની વિગત એન.એ.યુ.સ્પેક્ટ્રુમમાં મોકલવી. |
| ૧૮ | કોન્ટ્રાક્ચ્યુઅલ સ્ટાફ કૌશિક વાદી મુખ્ય સહાયક તરીકે રહેશે. જરૂર પડયે અન્ય કોઈપણ કોન્ટ્રાક્ચ્યુઅલ સ્ટાફની મદદ લેવી. |
| ૧૯ | કેન્દ્રના રીપોર્ટીંગમાં જરૂર પડે ત્યારે વિષયને લગતી ફોટોગ્રાફસ પસંદ કરી સંબંધિતોને પહોંચાડવા. |
| ૨૦ | કેન્દ્ર તથા યુનિટના વડા વખતોવખત સૌપે તે કામગીરી કરવી. |
| ૨૧ | કોન્ટ્રાક્ચ્યુઅલ સ્ટાફ કેતનભાઈ મુખ્ય સહાયક તરીકે રહેશે. જરૂર પડયે અન્ય કોઈપણ કોન્ટ્રાક્ચ્યુઅલ સ્ટાફ ની મદદ લેવી. |

(૭) શ્રીમતિ નિતલબેન એન. પટેલ, વૈજ્ઞાનિક (ગૃહ વિજ્ઞાન) (K-6)

| | |
|---|---|
| ૧ | કેવીકે ગૃહવિજ્ઞાન ને લગતી વિવિધ તાલીમ કાર્યક્રમોનું આયોજન તેમજ અમલીકરણ કરવું તથા સબંધી ફાઈલો/રેકૉર્ડ ની જાળવણી કરવી. |
| ૨ | કેન્દ્ર ખાતે Value added samples નું નાનું સરખું પ્રદર્શન તૈયાર કરવું. |
| ૩ | ZREAC, AGRESCO, APR, QPR & MPR સંબંધિત રીપોર્ટીંગની કામગીરી K-1-1 સાથે કરવી. |
| ૪ | વોકેશનલ ટ્રેનીંગ ગોઠવવી. ખેડૂતોના મૂલ્યવર્ધનોની વેચાણ વ્યવસ્થા કેન્દ્ર ખાતે સંભાળવી. કેન્દ્રમાં ગ્રામીણ મહિલાઓના જૂથ બનાવવા અને જીવિંત સંપર્ક રાખવા કેન્દ્ર ખાતે તમામ મહિલા કાર્યક્રમોના આયોજનમાં સંપૂર્ણ જવાબદારી સંભાળવી. " આંતરરાષ્ટ્રીય મહિલા દિન " તથા અન્ય " મહિલા સશક્તિકરણના મેળા ઈવેન્ટ્સ " ગોઠવામાં મુખ્ય ભૂમિકા ભજવવી. |
| ૫ | લાઈફ્સ્ટ્રેચરી અપડેટ કરવી તથા પુસ્તકોની જાળવણી. |
| ૬ | કચેરીમાં તાંત્રિક માહિતી અને ખેડૂતોપયોગી સાહિત્યની ડીસ્ક્લે સિસ્ટમ ગોઠવવી. નેર્ધમ પ્લેટ, સાઈનબોર્ડ, સ્લોગનબોર્ડ/વિ.તૈયાર કરવાની કામગીરી. |
| ૭ | ગૃહવિજ્ઞાનને લગતી અશ્રીમ હરોળ નિર્દર્શનો(FLD) અને ફાર્મ પરના અખતરાં(OFT) સબંધી કામગીરી. આ માટે જરૂરી ઈનપુટસની ખરીદી અને વિતરણ સંબંધી પત્રવ્યવહાર/રજિસ્ટ્રેશન/ફાઈલોની જાળવણી. |
| ૮ | કેવિકેમાં ખેડૂતો માટે કૃષિ માહિતી કોન્સરશન શરૂ કરવું જેમાં ખેડૂતોના પત્રોના જવાબો, ટેલિફોન દ્વારા માર્ગદર્શન, કૃષિ સાહિત્ય વેચાણ, મુલાકાતી ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ વિ. કામગીરી નિભાવવી. |
| ૯ | કેન્દ્રના રીપોર્ટીંગમાં જરૂર પડે ત્યારે વિષયને લગતી ફોટોગ્રાફસ પસંદ કરી સંબંધિતોને પહોંચાડવા. |

| | |
|----|---|
| ૧૦ | કેન્દ્ર તથા યુનિટના વડા વખતોવખત સૌંપે તે કામગીરી કરવી. |
| ૧૧ | કોન્ટ્રાક્ચ્યુઅલ સ્ટાફ દામિની મુખ્ય સહાયક તરીકે રહેશે. જરૂર પડયે અન્ય કોઈપણ કોન્ટ્રાક્ચ્યુઅલ સ્ટાફ ની મદદ લેવી. |

(૮) પ્રદિપ આર. રાઠવા, (તાલીમ સહાયક) (K-7)

| | |
|----|---|
| ૧ | ZREAC/AGRESCO ના રીપોર્ટીંગ માટે તમામ વિષયકની માહિતીનું જરૂર પડયે કોમ્પાઇલેશન/ટાઈપીંગ તથા તે સબંધીય તમામ પત્રવ્યવહાર રેકૉર્ડ નિભાવવા. |
| ૨ | વિષય નિષ્ણાંતશ્રીઓને તાંત્રિક કામગીરીમાં મદદરૂપ થવું. |
| ૩ | કેવીકે બિલ્ડીંગની સ્વસ્થતા તથા સજાવટની કામગીરી અને બ્યુટીફિકેશનની કામગીરીમાં કે-૬ ને મદદ કરવી. |
| ૪ | કેન્દ્રના રીપોર્ટીંગમાં જરૂર પડે ત્યારે વિષયને લગતા ફોટોગ્રાફસ પસંદ કરી સંબંધિતોને પહોંચાડવા. |
| ૫ | કેન્દ્ર તથા યુનિટના વડા વખતોવખત સૌંપે તે કામગીરી કરવી. |
| ૬ | APR/Action plan/SAC Report માટેની માહિતી એકટી કરી કે-૧.૧ અને કે-૫ સાથે ફાઈનલ રીપોર્ટ તૈયાર કરવાની જવાબદારી સંભાળવી. |
| ૭ | Documentation ના રજીસ્ટર તૈયાર કરવા. |
| ૮ | પ્રેસનોટ, પત્રકાર પરિષદ, સાહિત્ય, લેખો વગેરેને મેગેજીન તથા ડેનિકપત્રમાં પ્રસિદ્ધ કરાવવાની કામગીરી |
| ૯ | કેવિકે કેન્દ્રના સુશોભનમાં ધ્યાન આપવું. |
| ૧૦ | કેવિકેના વહીવટી બિલ્ડીંગ અંદરની સાફ્ટફાર્ક નિયમીત થાય તે બાબતે સંપૂર્ણ દેખરેખ રાખવી. |
| ૧૧ | GeM Portal પરની ખરીદીની કામગીરી |
| ૧૨ | કોન્ટ્રાક્ચ્યુઅલ સ્ટાફ મયુરી પટેલ મુખ્ય સહાયક તરીકે રહેશે. જરૂર પડયે અન્ય કોઈપણ કોન્ટ્રાક્ચ્યુઅલ સ્ટાફ ની મદદ લેવી. |

(૮) શ્રી અલ્પેશભાઈ અન. લાડ, ફાર્મ મેનેજર (K-8)

| | |
|----|---|
| ૧ | ફાર્મને લગતી કામગીરી, મજૂરો પર દેખરેખ રાખવી તથા મજૂર મસ્ટર અને તેને લગતા રજીસ્ટરો નિભાવવા. તથા કોન્ટ્રાક્ચ્યુઅલ સ્ટાફ સેજલ પટેલની મદદ લેવી. |
| ૨ | ટ્રેક્ટરની લોગબુક/હિસ્ટ્રી શીટની જાળવણી કરવી. |
| ૩ | વ્યક્તિગત ફાર્મ પ્લોટની ફોટોગ્રાફી મળવી જોઈએ. |
| ૪ | હોસ્ટેલ તથા વહીવટી બિલ્ડીંગ બધાર સાફ્ટ-સફાઈ કરાવવી. |
| ૫ | ગાઈનને રશિમકાંત ગુર્જર પાસેથી માર્ગદર્શન લઈ વિકસાવવું (લોન + ઝાડ). |
| ૬ | ૧૦૦ ટકા ટ્રીપ ઇરીગેશનનું ઇન્સ્ટોલેશન કરવું. |
| ૭ | નેટ હાઉસ, શ્રીન હાઉસ, વર્મિકંપોસ્ટ શેડ વગેરેમાં પાકનું નિયમીત આયોજન કરવું. |
| ૮ | Kitchen garden ની સાફ્ટ-સફાઈ કરી નવું વાવેતર કરવાની તૈયારી કરવી. |
| ૯ | ફાર્મ ખાતેના પાકોમાં નિંદામણ તથા પિયતની વ્યવસ્થા કરવી. |
| ૧૦ | કેન્દ્ર ખાતે વાવેલ દરેક ઝોડ - વૃક્ષોની જાળવણી કરવી. |
| ૧૧ | ચોમાસા પહેલાની શેઢાપણા - કેનાલ - નિક વગેરેની સાફ્ટ-સફાઈ કરાવવી. |
| ૧૨ | વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રોક્યુરની ટેક સાફ્ટ-સફાઈ કરી આગળની ફિલ્ટર ટાંકી રીપેર કરાવવી અન્ય ઘટતું કામકાજ કરાવવું. |
| ૧૩ | કોન્ટ્રાક્ચ્યુઅલ સ્ટાફ હર્ષદ પટેલ મુખ્ય સહાયક તરીકે રહેશે. જરૂર પડયે અન્ય કોઈપણ કોન્ટ્રાક્ચ્યુઅલ સ્ટાફ ની મદદ લેવી. |
| ૧૪ | કેન્દ્ર તથા યુનિટના વડા વખતોવખત સૌંપે તે કામગીરી કરવી. |

(૯) શોનક માંકડ, પ્રોગ્રામર (K-10)

| | |
|---|---|
| ૧ | કચેરીના વડાનો પત્ર વ્યવહારનું ગુજરાતી/અંગ્રેજી ટાઈપીંગ કરવું. |
| ૨ | કેન્દ્રના કર્મચારીઓની કોન્ફિડેન્શીલ માહિતીનું ટાઈપીંગ /ફાઈલીંગ તથા સબંધીત તમામ રેકૉર્ડ્સ રાખવા. |
| ૩ | કચેરીના તમામ પત્ર વ્યવહારનું ઇનવર્ટ/આઉટવર્ટ ની કામગીરી તથા સબંધીત તમામ રેકૉર્ડ્સ જાળવવા. |
| ૪ | પોસ્ટલ - રજીસ્ટર સંભાળવા. |
| ૫ | Resource person ની યાદી બનાવવી. |
| ૬ | ટેલિફોન ડિરેક્ટરી બનાવવી. |

| | |
|------|---|
| ૭ | કેવિકે ખાતે આવતા ખેડુતો અને અન્ય મુલાકાતીઓની નોંધણી કરવી / કરાવવી. |
| ૮ | સંદેશાવ્યવહાર કરેલ પત્રોનું ફોલોઅપ કરવું વગેરે. |
| ૯ | CL રજીસ્ટર નિભાવવું. |
| ૧૦ | ઈનવર્ક આઉટવર્ક જોવું. |
| ૧૧ | ઈ-મેઇલ પત્રવ્યવહાર કરવો. |
| ૧૨ | કચેરીના K-1 ટેબલની તમામ ફાઈલો સંભાળવી. |
| ૧૩ | તમામ કમ્પ્યુટરનાં રીપેરીગની જવાબદારી. (કોમ્પ્યુટર પ્રોગ્રામરની ગેરહાજરી હોય ત્યારે) |
| ૧૪ | K-1 સ્ટેશનરીની સુવિધા તથા કમ્પ્યુટરને લગતી તમામ જરૂરિયાતો પૂરી પાડવી. |
| ૧૫ | ટુંકી નોંધો તૈયાર કરવી. |
| ૧૬ | દૈનિક પત્રો ના કોલમો મેઇલ કરવાં અને ફોલોઅપ કરવું |
| ૧૭ | ખાનગી પત્રવ્યવહાર સંભાળવો. |
| ૧૮ | PC ની અન્ય બેઠક / મીટિંગની નોંધ પ્લાનર પર લખવી. |
| ૧૯ | ન્યૂઝ પેપરની નિયમિતતા. |
| ૨૦ | ઈન્ટરકોમ ટેલિફોનની જાળવણી કરવી. |
| ૨૧ | કચેરીના K-1 નો પત્રવ્યવહાર તથા તમામ અધિકારશીઓનો પત્રોના નિયમિત જવાબો જાય તે બાબતે કચેરીના વડાને ધ્યાને મૂકવું. |
| ૨૨ | કોન્ટ્રાક્ચ્યુઅલ સ્ટાફ હેમીષા પટેલ મુખ્ય સહાયક તરીકે રહેશે. જરૂર પડ્યે અન્ય કોઈપણ કોન્ટ્રાક્ચ્યુઅલ સ્ટાફ ની મદદ લેવી. |
| ૨૩ | કેન્દ્ર તથા યુનિટના વડાની અન્ય જગ્યાએથી મળતી સુચનાઓનું ફોલોઅપ કરાવવું |
| ૨૪ | કેન્દ્ર તથા યુનિટના વડા વખતોવખત જે કામગીરી સોંપે તે નિભાવવી. |
| ૨૫ | કેવીકેમાં આવેલ તમામ કમ્પ્યુટર, પ્રિન્ટર્સ, લેરોક્સ મશીન વિગેરેનો સંપૂર્ણ હવાલો |
| ૨૬ | તમામ ઉપકરણોની સર્વિસ, મેન્ટેનન્સ તથા અપડેટીંગ રાખવું. તથા કચેરીના તમામ કોમ્પ્યુટર અને લેપટોપના રીપેરીગની જવાબદારી. |
| ૨૭ | કેવિકે/એટીક ખાતે આયોજીત તાલીમ, સેમીનાર, વર્કશોપ દરમાન કોન્ફરન્સ હોલ/તાલીમ ખંડમાં /એલ સી ડી ની ગોઠવણ કરવી. |
| ૨૮ | તાંત્રિક અધિકારીશીઓના પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવવામાં મદદરૂપ રહેવું. |
| ૨૯ | કેવિકે ખાતે તમામ ઈલેક્ટ્રોનિક/ઈલેક્ટ્રીકલ ઉપકરણોની ખરીદી માટે યુનિટ વડાને તાંત્રિક સલાહ સુચન તથા પત્ર વ્યવહાર કરી તેના સંબંધીત રેકોર્ડ્સ જાળવવા. |
| ૩૦ | વાર્ષિક અહેવાલ બનાવવામાં કે-૧-૧, કે-૬ તથા કે-૮ ને તાંત્રિક મદદરૂપ રહેવું |
| ૩૧ | ટેલિફોન/ફેક્સ તેમજ ઈન્ટરનેટ ને લગતી તમામ પ્રકારની કામગીરી અને પત્ર વ્યવહાર કરવો. તેને લગતા તમામ પ્રકારના રિઝીસ્ટર /મંજુરી વગેરેની કાર્યવાહી કરવી. |
| ૩૨ | વહિવટી/હિસાબી કામગીરીમાં કોમ્પ્યુટર ટાઈપીંગ |
| ૩૩ | કેન્દ્ર ખાતે IT નો ઉપયોગ કરવા સંબંધિત તમામ જવાબદારી સંભાળવી. |
| ૩૪ | કેન્દ્ર ખાતે ઈન્ટરનેટ સેવા સતત અને કાર્યક્ષમ રીતે કાર્યરત રહે તે જોવું. |
| ૩૫ | ટેકનોલોજી ટ્રાન્સફરની કામગીરીમાં મહત્તમ IT નો ઉપયોગ થાય તે સબખ કામગીરી કરવી. |
| ૩૬ | કેવિકે એકાઉન્ટસ, ઈ-કેવિકે ની સંપૂર્ણ જવાબદારી |
| ૩૭ | કેન્દ્ર તથા યુનિટના વડા વખતો વખત જે કામગીરી સોંપે તે નિભાવવી. |
| (૧૧) | નરેન્દ્ર એમ.પટેલ, સીનીયર કલાર્ક (ADM) |
| ૧ | કચેરી સંલગ્ન તમામ વહિવટી રેકોર્ડ્સની નિભાવણી અને જાળવવી કરવી. |
| ૨ | તમામ કર્મચારીઓ ની સર્વિસ બુક, પર્સનલ પી. એફ /સી.પી.એફ.બુક/ફાઈલો તથા સી.આર ના રેકોર્ડ્સ રાખવા. |
| ૩ | તમામ નાણાંકીય વ્યવહાર ICAR /યુનિ.તથા અધિર એજન્સી સાથે જાળવવા તથા તે સંબંધી રેકોર્ડ્સ નીભાવવા. |
| ૪ | કૃષિ વિશ્લેષણ કેન્દ્રના તમામ બજેટ સદરની ગ્રાન્ટની દરખાસ્ત, ડીમાન્ડ ઓફ ફંડ, ઓડિટ યુટિલાઈઝેશન સર્ટીફીકેટ વિ. અંગે સમયસર કામગીરી થાય તે જોવું, કચેરીનું નિયમિત ઓડિટ કરાવવું તેમજ તે અંગેના રકોર્ડ નિભાવવા. |
| ૫ | કચેરીની સ્ટેશનરી ખરીદી, રીકરીગ/નોન રીકરીગ, ડેડસ્ટોક વગેરે ખરીદીના બિલોની કાર્યવાહી. |

| | |
|------|---|
| ૬ | ડીમાન્ડ ઓફ ફંડ, AUC, કેશબુક (જનરલ તથા રીવોલ્વીગ ફંડ), પગાર બીલ/પગાર ભથ્થા /ટીએ બીલ, એબેસ્ટેક્ટ બીલ, પે.ડી.સી/એન. પી.ડી.સી બીલ બનાવવા, અન્ય તમામ નાણાંકીય વ્યવહાર નિભાવવા તથા તેને સંબંધિત જરૂરી ફોમ્સ /રજીસ્ટર રેકૉર્ડ રાખવા. |
| ૭ | કચેરીના તમામ હિસાબો વખતો વખત કંમટ્રોલરશી ની કચેરી ખાતે મેળવવા તથા ICAR/યુનિ સાથે નાણાંકીય બાબતે પત્ર વ્યવહાર જાળવવો. |
| ૮ | યુનિવર્સિટી ખાતેની મળવા પાત્ર તમામ સ્ટેશનરી /રજીસ્ટરો /રેકોડસ/ફોમર્સ મેળવવા તથા તેની જાળવણી કરવી અને કર્મચારી/અધિકારીની માંગ મુજબ પુરા પાડવા |
| ૯ | કચેરીના કોઈ કર્મચારી /અધિકારીને ન ફણવાયેલ હોય તેવા તમામ વિભાગના પત્ર વ્યવહાર /તે સંબંધી ફાઈલો/રેકોડસ રજીસ્ટરોની જાળવણી |
| ૧૦ | કોન્ટ્રાક્ચ્યુઅલ સ્ટાફ દિવ્યા પટેલ અને હરસીલ પટેલ મુખ્ય સહાયક તરીકે રહેશે. જરૂર પડ્યે અન્ય કોઈપણ કોન્ટ્રાક્ચ્યુઅલ સ્ટાફની મદદ લેવી. |
| ૧૧ | કચેરીના વડા વખતો વખત સોંપે તે કામગીરી બજાવવી. |
| (૧૨) | શ્રી એચ. જોડ ઘોણાણ, ડ્રાઇવર કમ મેકેનિકલ |
| ૧. | ઓફિસની જીપ ચલાવવી. |
| ૨. | કેન્દ્ર ખાતેના તમામ વાહનોની તથા લોગબુકની જાળવણી. |
| ૩. | વાહનોના વીમા તથા અન્ય જરૂરી રીપેરીગ, જાળવણીની કામગીરી |
| ૪. | હેડ ઓફ ઓફિસ /યુનિટ હેડ વખતોવખત સોંપે તે કામગીરી. |

મુદ્દા નંબર :- ઉ દેખરેખ અને જવાબદારીના માધ્યમ સહિત નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્ય રીતિ:-

વહીવટી-વ-હિસાબી કર્મચારી / વૈજ્ઞાનિક » વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા » વિસ્તરણ શિક્ષણ નિયામકશી/ સંશોધન નિયામકશી /કુલસચિવશી » કુલપતિશી / ડાયરેક્ટરશી ATARI, પૂણે

મુદ્દા નંબર :-૪ પોતાના કાર્યો બજાવવા માટે પોતે નક્કી કરેલા ઘોરણા:-

| | |
|----|---|
| ૧. | ખેડૂતો અને ગ્રામીણ યુવાનો માટે "કાર્ય દ્વારા શિક્ષણ" પર ભાર મુકીને કૃષિ અને સંલગ્ન વિષયો અંગે ટૂકાં તેમજ લાંબાગાળાના વ્યાવસાયિક તાલીમવર્ગો યોજીને સ્વરોજગારી વધારવાનો પ્રયત્ન કરવો. |
| ૨. | નવીન કૃષિ તજશાતોઓ અંગે ખેડૂતોના પ્રતિભાવો જાણવા માટે ખેડૂતોના ખેતરો ઉપર વિવિધ પાકોના અગ્રીમ હોણના નિર્દર્શનો (Front line demonstrations) યોજવા. |
| ૩. | સ્થાનિક પરિસ્થિતિને અનુસુધ ટકાઉ ખેતી પદ્ધતિઓ વિકસાવવા માટે નવી બહાર પાડવામાં આવતી કૃષિ તજશાતાઓની જુદી જુદી કૃષિ-આભોહવાકીય પરિસ્થિતિમાં યોગ્યતા અને અનુકૂળતા ચકાસવા માટે તથા ખેડૂતોને તે પ્રત્યક્ષ બતાવવા માટે ખેડૂતોના ખેતરો પર ક્ષેત્રિય-અભતરા(On-farm trials)નું આયોજન કરવું. |
| ૪. | કૃષિ અને સંલગ્ન વિષયોના સંશોધનો સંબંધી અધ્યતન માહિતી અંગે જે તે કાર્યક્ષેત્ર વિસ્તારના વિસ્તરણ કાર્યક્રમ/અધિકારીઓને જાણકારી આપીને નવીન તજશાતા અંગેના શાનમાં વધારો કરવા માટે નિયમિત રીતે તાલીમ કાર્યક્રમો યોજવા. |

મુદ્દા નંબર :- ૫ પોતાના કાર્યો બજાવવા માટે પોતાની પાસેના અથવા પોતાના નિયંત્રણ હેઠળના અથવા પોતાના કર્મચારીઓ દ્વારા ઉપયોગમાં લેવાના નિયમો, વિનિયમો, સૂચનાઓ, નિયમસત્રી અને રેકૉર્ડ :-

કૃષિ યુનિવર્સિટીની સ્ટેચ્યુટરી જોગવાઈઓ મુજબ નિયમો, વિનિયમો અને સૂચનાઓને અનુસરવામાં આવે છે તેમજ માન. રાજ્ય સરકારશીના કૃષિ અને સહકાર વિભાગના આદેશો અનુસાર તથા કેન્દ્ર સરકારશીના આઈસીએઆરની માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવે છે તથા હિસાબી કામગીરીનું લોકલ ફંડ ઓડીટરશી દ્વારા ઓડીટ કરાવવામાં આવે છે. તેમજ અત્રેના એકમ દ્વારા જરૂરી રજીસ્ટરો નિભાવવામાં આવે છે જેવા કે, ડેડસ્ટોક, સ્ટોર રોજમેળ, ચીજવસ્તુ વપરાશ, મંજુરી રજીસ્ટર, લેબરસીટ, હાજરીપત્રક, રીપેરીગ, સાધનોની લોગબુક, વાહનની લોગબુક અને હીસ્ટ્રીસીટ, નમૂના રજીસ્ટર, પરચૂરણ રજા, ટપાલ આવક જાવક તથા હિસાબી રજીસ્ટરો જેવા કે કેશબુક, રસીદ બુક, માસિક ખર્ચ પત્રક રજીસ્ટર વિગેરે રેકૉર્ડની નિભાવણી કરવામાં આવે છે.

મુદ્દા નંબર :— ૬ પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દરસ્તાવેજોના
વર્ગોનું પત્રક :—

૧. ટેકનીકલ(તાંત્રીક) દસ્તાવેજો

| અ.નં. | ટેબલ | ફાઈલનો વિષય |
|-------|---|--|
| ૧. | કે-૧ ડૉ.સી.કે. ટીબીયા વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા | ૧. કેવિકે, નવસારીની શરૂઆત ૧૮/૦૩/૦૬ થી ૩૧/૦૩/૦૮ ની ફાઈલ ૨. કેવિકે, નવસારી : મકાન બાંધકામની ફાઈલ ૩. કેવિકે, નવસારી : ઝેરોક્ષ મશીનની ખરીદીની ફાઈલ ૪. કેવિકે, નવસારી : ઝોનલ વર્કશોપ ૫. કેવિકે, નવસારી : એન્યુઅલ પ્રોગ્રામ રીપોર્ટસ એન્ડ એક્શન ફાઈલ ૬. કેવિકે, નવસારી : ATMA ફાઈલ ૭. કેવિકે, નવસારી : જનરલ એડમિનિસ્ટ્રેશન ૮. કેવિકે, નવસારી : QRT Report ૯. કેવિકે, નવસારી : ATMA Project ઠરાવ ફાઈલ ૧૦. Zonal Coordinator – Technical Correspondence ૧૧. કેવિકે એવોર્ડફાઈલ ૧૨. Oxford Dictionary – 3 Volume ૧૩. નવસારી જીલ્લાનાં પ્રગતિશીલ ખેડૂતોની યાદી ૧૪. RKVY Project File ૧૫. PRA Report File ૧૬. ZREAC, Agresco & Annual Progress Report |
| ૨. | કે-૧-૧ ડૉ. સુમિત આર. સાળુંભે વૈજ્ઞાનિક (વિસ્તરણ શિક્ષણ) | ૧. આર.ટી.આઈ. ફાઈલ ૨. ઓન કેમ્પસ ટ્રેનીંગ રજીસ્ટર ૩. ઓફ કેમ્પસ ટ્રેનીંગ રજીસ્ટર ૪. ટેબલને લગતા પત્રવ્યવહારની ફાઈલ ૫. આત્મા પત્રવ્યવહાર ફાઈલ ૬. એફ.એલ.ડી. ખરીદી ફાઈલ ૭. ઓ.એફ.ટી. ખરીદી ફાઈલ |
| ૩. | કે-૨ ડૉ.કે.એ.શાહ (વૈજ્ઞાનિક- સસ્યવિજ્ઞાન) | ૧. ઓન કેમ્પસ ટ્રેનીંગ રજીસ્ટર ૨. ઓફ કેમ્પસ ટ્રેનીંગ રજીસ્ટર ૩. સીડ વિલેજ ફાઈલ ૪. માટી નમુના વિતરણ ફાઈલ ૫. આર.કે.વી.વાય. ફાઈલ ૬. વિષયને સંબંધીત એફ.એલ.ડી/ ઓ.એફ.ટી/ તાલીમ અંગોના ખર્ચની ફાઈલ ૭. પ્લાન યોજના ફાઈલ |
| ૪. | કે-૩ શ્રી આર.એ.ગુર્જર (વૈજ્ઞાનિક- બાળાયત) | ૧. એફ.એલ.ડી. ખરીદી ફાઈલ ૨. ઓ.એફ.ટી. ખરીદી ફાઈલ ૩. ટ્રેનીંગ રજીસ્ટર ૪. ટી.એસ.પી. ફાઈલ ૫. વિષયને સંબંધીત એફ.એલ.ડી/ ઓ.એફ.ટી/ તાલીમ અંગોના ખર્ચની ફાઈલ |

| | | |
|----|---|--|
| ૫. | કે-૪ શ્રી પ્રકાશ .પી.પટેલ (વૈજ્ઞાનિક- મત્સ્યપાલન) | ૧. ખાન સિકમ (એસ્ટાબ્લીસમેન્ટ ઓફ ટ્રેનિંગ કમ ડેમોનસ્ટ્રેશન સેન્ટર ઇન ઇન્ડિયન ફિશરીઝ-૧૨૮૪૭)ને લગતી ફાઈલો ૨. તાલીમ રજીસ્ટર ૩. મત્સ્યખેડૂત મુલાકાતી રજીસ્ટર ૪. વિષયને સંબંધિત એફઅલટી/ઓએફટી/તાલીમ અગેની ફાઈલ ૫. હોસ્પિટ સંબંધિત રજીસ્ટર, પત્રવ્યવહાર |
| ૬. | કે-૫ ડા.પ્રભુ નાયકા (વૈજ્ઞાનિક- પાક સંરક્ષણ) | ૧. ઓન કેમ્પસ ટ્રેનીંગ રજીસ્ટર ૨. ઓફ કેમ્પસ ટ્રેનીંગ રજીસ્ટર ૩. ટેબલને લગતી પત્રવ્યવહારની ફાઈલ ૪. તાલીમ રજીસ્ટર ૫. વાહનની લોગ બુક (બોલેરો, બાઈક) ૬. વાહનની લોગ બુક (મોબા. વાન) ૭. વાહનની હીસ્ટ્રી શીટ (બોલેરો, બાઈક) ૮. વાહનની હીસ્ટ્રી શીટ (મોબા. વાન) ૯. એન.એ.યુ. સ્પેક્ટ્રમની ફાઈલ ૧૦. ATARI સાથેના પત્ર વ્યવહારની ફાઈલ |
| ૭. | કે-૬ શ્રીમતિ નિતલબેન.એન.પટેલ (વૈજ્ઞાનિક- ગૃહ વિજ્ઞાન) | ૧. એફ.એલ.ડી., ઓ.એફ.ટી. અંતર્ગત ઇનપૂટસ સામગ્રીની પહોંચ ફાઈલ ૨. લાઈબ્રેરી રજીસ્ટર ૩. સામયીક મેગેઝીન નોંધણી રજીસ્ટર ૪. લાઈબ્રેરી બુક ઇસ્યુ રજીસ્ટર ૫. લાઈબ્રેરી પત્ર વ્યવહાર ફાઈલ ૬. પરચૂરણ પત્ર વ્યવહાર ફાઈલ ૭. વિષયને સંબંધિત એફ.એલ.ડી/ ઓ.એફ.ટી. અંગેના ખર્ચની ફાઈલ ૮. મંજુરી રજીસ્ટર |
| ૮. | કે-૭ શ્રી પ્રદિપ આર. રાઠવા (તાલીમ સહાયક) | ૧. ડેડસ્ટોક રજીસ્ટર (કેવિકે, આર.કે.વિ.વાય.) ૨. સ્ટોર રોજમેળ (૨૦૭૬-૧૮, ૨૭૦૪-૨) ૩. ચીજ-વસ્તુ વપરાશ રજીસ્ટર (૨૦૭૬-૧૮, ૨૭૦૪-૨) ૪. સ્ટેશનરી રજીસ્ટર (કેવિકે, આર.કે.વિ.વાય.) ૫. કેવિકેની તમામ પ્રવૃત્તિઓના રીપોર્ટિંગની ફાઈલો. ૬. કેવિકેના મંથલી, કર્વાટરલી અને એન્યુઅલ રીપોર્ટ |
| ૯. | કે-૮ શ્રી એ.એન.લાડ (ફાર્મ મેનેજર) | ૧. ફાર્મના પત્ર વ્યવહારની ફાઈલ ૨. ઉત્પાદન રજીસ્ટર ૩. ગોટ પાસ ૪. જનરલ પાક યોજના -અ, બ ૫. વાહનની લોગ બુક (ટ્રેકટર, પાવર ટ્રેલર) ૬. વાહનની હીસ્ટ્રી શીટ (ટ્રેકટર, પાવર ટ્રેલર) ૭. ફેનિક મજુરી પત્રક ૮. મજૂર તારીજ પત્રક ૯. ઉધાર બીલ બુક ૧૦. કેશ મેમો ૧૧. કેશ મેમો - એબાસ્ટ્રેક બુક ૧૨. કચેરીમાં નાણાં ભરવાના પત્રક ૧૩. પાવર ખાન રજીસ્ટર |

| | | |
|-----|---------------------------------|--|
| ૧૦. | કે-૧૦ શૌનક માંકડ, પ્રોગ્રામર | <ol style="list-style-type: none"> ૧. મુલાકાતી રજીસ્ટર ૨. હાજરી પત્રક (મસ્ટર રોલ) કેવિકે ૩. હાજરી પત્રક (મસ્ટર રોલ - ઉચ્ચાક દરે ઉમેદવારોના) ૪. ખાનગી અહેવાલ રજીસ્ટર ૫. દૈનીક પોસ્ટલ સ્ટેમ્પના ખર્ચ રજીસ્ટર - એ, બી ૬. સી.એ.લ. રજીસ્ટર ૭. ઈનવર્ડ - આઉટવર્ડ રજીસ્ટર ૮. અંગત ફાઈલ |
|-----|---------------------------------|--|

૨. વહીવટી દસ્તાવેજો

| અ.નં. | ટેબલ | ફાઈલનો વિષય |
|-------|---|---|
| ૧. | શ્રી નરેન્દ્રભાઈ એમ.પટેલ સીનીયર કલાર્ક (ADM) | <ol style="list-style-type: none"> ૧. કેન્દ્રના દરેક અધિકારી/ કર્મચારીઓની સેવાપોથી/ રજા હિસાબ પુસ્તીકા/ જામીન ખંત વગેરે દસ્તાવેજોની યોગ્ય જાળવણી તેને લગતા સંઘળા રજીસ્ટરો ૨. કેન્દ્રના માસિક ત્રિમાસિક પત્રકો અંગેની ફાઈલ. ૩. જનરલ પત્ર વ્યવહારની ફાઈલ. ૪. ઓડિટ અંગેના રેકર્ડની ફાઈલ. ૫. દરાવો પરિપત્રની ફાઈલ. ૬. કેન્દ્ર પર નિવૃત થનાર અધિકારી/ કર્મચારીઓની પેન્શાન દરખાસ્તની ફાઈલ. ૭. કર્મચારીઓની પ્રવાસ ડાયરીની ફાઈલ ૮. બજેટ ફાઈલ ૯. ગ્રાન્ટના હુકમોની ફાઈલ |

૩. હિસાબી દસ્તાવેજો

| અ.નં. | ટેબલ | ફાઈલનો વિષય |
|-------|--|--|
| ૧. | ADM શ્રી નરેન્દ્રભાઈ એમ.પટેલ સીનીયર કલાર્ક | <ol style="list-style-type: none"> ૧. કેશબુકની ફાઈલ ૨. વાઉચરોની ફાઈલ. ૩. એન.પી.ડી.સી. બીલો, પે.ડી.સી. બીલોની ફાઈલ. ૪. કેન્દ્રના ખર્ચ - આવક અંગેના રજીસ્ટરો ૫. ઈન્કમટેક્ષ, પ્રો.ટેક્ષ, ચલાણો વગેરેની ફાઈલ. ૬. જે તે નાણાંકીય વર્ષમાં ખર્ચ - આવકની ફાઈલ. |

મુદ્દા નંબર :— ૭ તેની નીતિ ઘડતરના અથવા તેના અમલીકરણ સર્બંધ જનતાના સભ્યો સાથે વિચારવિનિમય માટે અથવા તેમના દ્વારા રજુઆત માટેની વિધમાન કોઈ વ્યવસ્થાની વિગતો:-

PRA સર્વે દ્વારા ગામના લોકોને સહભાગી બનાવી શ્રસ્ટ એરીયા નક્કી કરી તે પ્રમાણે ખેતી વિષયક તાલીમો અને વિસ્તરણ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.

મુદ્દા નંબર :— ૮ તેના ભાગ તરીકે અથવા તેની સલાહના હેતુ માટે બે અથવા તેથી વધુ વ્યક્તિત્વોના બનેલા બોર્ડ, કાઉન્સીલો, સમિતિ અને બીજા મંડળોનું પત્રક અને તે બોર્ડ, કાઉન્સીલો, સમિતિ અને બીજા મંડળોની બેઠકો લોકો માટે ખુલ્લી છે કે કેમ અથવા તેવી બેઠકોની કાર્યનોંધો લોકોને મળવાપાત્ર છે કે કેમ :-

તેના ભાગ તરીકે બોર્ડ, કાઉન્સિલ, સમિતિ અને બીજા મંડળોની બેઠકો બનાવવામાં આવેલ નથી. પરંતુ વૈશાનિક સલાહકાર સમિતિ બનાવવામાં આવેલ છે. જેમાં ફક્ત સભ્યશ્રીઓ જ ભાગ લઈ શકે છે.

Scientific Advisory Committee of Krishivigyan Kendra, Navsari

| Sr. No | Name | Designation | Committee status |
|--------|---------------------------|---|------------------|
| 1 | Dr.Z.P.Patel | Hon. Vice-Chancellor, NAU, Navsari. | Chairperson |
| 2 | Dr. C.K.Timbadia | Director of Extension Education, N.A.U., Navsari. | Member |
| 3 | Dr. Lakhan Singh | Director, ICAR- ATARI, Zone-VIII, College of Agriculture Campus, PUNE - 411005 (Maharastra) | Member |
| 4 | Dr. Sunil Chaudhary | Director of Research, N.A.U., Navsari. (Representative of ICAR) | Member |
| 5 | Dr. J. D. Thanki | Professor & Head (Agronomy), NMCA, NAU, Navsari | Member |
| 6 | Dr. P.K.Shrivastav | I/C Principal, ASPEE College, NAU, Navsari | Member |
| 7 | Dr. N.B.Patel | Research Scientist (LRS), NAU, Navsari | Member |
| 8 | Dr. R.V. Borichangar | Associate Professor, College of Fisheries Science, NAU, Navsari. | Member |
| 9 | Dr.Atul Gajera | District Agriculture Officer, Dist. Navsari | Member |
| 10 | Mr.B.K. Rai Samant | Assistant General Manager, NABARD, Navsari | Member |
| 11 | Dr. Dineshbhai Padaliya | Deputy Director of Horticulture, Dist. Navsari | Member |
| 12 | Mr. Rajendra Rathod | Exe. Eng. (Drainage), Ambika Division, Dist. Navsari | Member |
| 13 | Dr. D.B.Thakur | Deputy Director of Animal Husbandry, Dist. Navsari | Member |
| 14 | Mr. Mohit Sangani | Assistant Director of Fisheries, Dist. Navsari | Member |
| 15 | Shri. C.K. Patel | Progressive Farmer, Village- Bhinar, Ta.Vansda | Member |
| 16 | Smt.Alpanaben M. Patel | Progressive Farm Woman, Village- Vasan, Ta.Gandevi | Member |
| 17 | Shri Amitbhai Naik | Director, Dhanori Piyat mandali and Seva sahakari Mandali, Village - Dhanori, Ta.Gandevi, Dist : Navsari | Member |
| 18 | Shri Surajbhai D. Savalia | Agri-entrepreneur, Village : Ganesh Sisodra, Dist : Navsari. | Member |
| 19 | Shri Kiranbhai M. Patel | Progressive farmer and Director, Navsari Taluka Sangh and Deputy Director Adada seva sahakri mandali, Village : Adada, Ta.Gandevi, Dist : Navsari | Member |
| 20 | Dr. C.K. Timbadia | Senior Scientist & Head, KVK, Navsari | Member Secretary |

મુદ્દા નંબર :—૮ તેના અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી પુસ્તિકા :—

| અ.નં. | અધિકારી /કર્મચારીનું નામ | હોદ્દો |
|-------|--------------------------|---------------------------------|
| ૧ | ડૉ. સી.કે. ટીબીયા | વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા |
| ૨ | ડૉ. કે. એ. શાહ | વૈજ્ઞાનિક (સસ્ય વિજ્ઞાન) |
| ૩ | પ્રો. પી.પી. પટેલ | વૈજ્ઞાનિક (મત્સ્યપાલન) |
| ૪ | ડૉ. પ્રભુ.એચ. નાયકા | વૈજ્ઞાનિક (પાકસંરક્ષણ) |
| ૫ | ડૉ. સુમીત આર. સાણુંખે | વૈજ્ઞાનિક (વિસ્તરણ શિક્ષણ) |
| ૬ | પ્રો. આર. એ. ગુર્જર | વૈજ્ઞાનિક (બાળાયત) |
| ૭ | શ્રીમતિ નિતલ એન. પટેલ | વૈજ્ઞાનિક (ગૃહ વિજ્ઞાન) |
| ૮ | ચીરાગ બી. નાયક * | પ્રોગ્રામ આસીસ્ટન્ટ –કોમ્પ્યુટર |
| ૯ | અલ્પેશ એન. લાડ | ફાર્મ મેનેજર |
| ૧૦ | પ્રદિપ આર.રાઠવા | તાલીમ સહાયક |
| ૧૧ | શ્રી. એચ.જેડ. ચૌહાણ | ડ્રાઇવર કમ મેકેનિકલ |
| ૧૨ | શૌનક માંકડ | પ્રોગ્રામર |
| ૧૩ | નરેન્દ્ર એમ.પટેલ | સીનીયર કલાર્ક |
| ૧૪ | સ્ટેનોગ્રાફર | વેકન્ટ |
| ૧૫ | ડ્રાઇવર | વેકન્ટ |
| ૧૬ | સપોર્ટિંગ સ્ટાફ | વેકન્ટ |

*** નોંધ :—**

- હાલમાં શ્રી ચિરાગ બી.નાયક, એભીએમ, નક્કુયુ, નવસારી ખાતે ફરજ બજાવે છે. પરંતુ તેઓનો પગાર ખર્ચ અત્રેની કચેરીમાં થાય છે. હાલમાં કોમ્પ્યુટર પ્રોગ્રામર તરીકેની સંપૂર્ણ કામગીરી શ્રી શૌનક માંકડ કરે છે.
- અત્રેની કચેરી ખાતે ફરજ બજાવતાં વૈજ્ઞાનિકશ્રી (મત્સ્યપાલન) તેમજ શ્રી શૌનક માંકડ (કોમ્પ્યુટર પ્રોગ્રામર) નો ખર્ચ કામદેનું યુનિવર્સિટીમાં થાય છે. પરંતુ કામગીરી અત્રેનાં કેન્દ્ર ખાતે ફાળવેલ છે.

મુદ્દા નંબર —૧૦ તેના વિનિયમોમાં જોગવાઈ કર્યા પ્રમાણે વળતરની પદ્ધતિ સહિત તેના દરેક અધિકારીઓ અને કર્મચારીઓને મળતાં માસિક મહેનતાણા :—

| અ.નં. | અધિકારીશ્રીનું નામ/ હોદ્દો | પગાર ધોરણ | કુલ પગાર |
|-------|--|-------------------|-----------|
| ૧ | ડૉ. સી.કે.ટીબીયા (વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા) | ૧૩૧૪૦૦— ૨૧૭૧૦૦ | ૧૮૪૨૦૨.૦૦ |
| ૨ | પ્રો. પ્રકાશ પી. પટેલ (વૈજ્ઞાનિક, મત્સ્યપાલન) | ૬૮૬૦૦— ૨૦૪૪૦૦ | ૮૩૬૪૪.૦૦ |
| ૩ | શ્રીમતિ નિતલ એન. પટેલ (વૈજ્ઞાનિક, ગૃહવિજ્ઞાન) | ૫૭૭૦૦— ૧૮૨૪૦૦ | ૮૩૩૭૭.૦૦ |
| ૪ | ડૉ.કિંજલકુમાર એ. શાહ (વૈજ્ઞાનિક, સસ્યવિજ્ઞાન) | ૬૮૬૦૦— ૨૦૪૪૦૦ | ૮૩૨૫૩.૦૦ |
| ૫ | પ્રો.રશિમકાંત એ. ગુર્જર (વૈજ્ઞાનિક, બાળાયત) | ૫૭૭૦૦— ૧૮૨૪૦૦ | ૮૦૭૬૬.૦૦ |
| ૬ | ડૉ.પ્રભુ.એચ. નાયકા (વૈજ્ઞાનિક, પાકસંરક્ષણ) | ૬૮૬૦૦— ૨૦૪૪૦૦ | ૮૩૩૭૭.૦૦ |

| | | | |
|----|--|------------------|----------|
| ૭ | ડૉ. સુમિત આર સાળુંખે (વૈજ્ઞાનિક, વિસ્તારણ શિક્ષણ) | ૫૯૭૦૦- ૧૮૨૪૦૦ | ૬૦૮૮૮.૦૦ |
| ૮ | શ્રી અલ્પેશકુમાર એ. લાડ (ફાર્મ મેનેજર) | ૩૬૬૦૦- ૧૨૬૬૦૦ | ૫૨૮૩૩.૦૦ |
| ૯ | શ્રી પ્રદીપ આર. રાઠવા તાલીમ સહાયક | ૩૮૦૬૦ | ૩૮૦૬૦ |
| ૧૦ | શ્રી ચિરાગકુમાર બી. નાયક (કોમ્પ્યુટર પ્રોગ્રામર) | ૩૬૬૦૦- ૧૨૬૬૦૦ | ૫૮૪૪૮.૦૦ |
| ૧૧ | શ્રી નરેન્દ્ર એમ. પટેલ (સીનીયર કલાક્ષ) | ૩૪૪૦૦- ૧૧૨૪૦૦ | ૬૩૧૨૩.૦૦ |
| ૧૨ | શ્રી હર્ષદકુમાર જેડ. ચૌહાણ (ડ્રોઇવર કમ મીકેનિકલ) | ૧૬૬૦૦- ૬૩૨૦૦ | ૩૦૭૮૮.૦૦ |

મુદ્દા નંબર -૧૧ તમામ યોજનાઓ, સુચિત ખર્ચ અને ચુકવેલા નાણાં પરના અહેવાલોની વિગતો દર્શાવતી, તેની દરેક એજન્સીને ફાળવેલ અંદાજપત્ર :

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી ખાતે ચાલતી વિવિધ યોજનાઓની માહિતી નીચે મુજબ છે.

| અ.નં. | બજેટ સદર | યોજનાનું નામ | યોજનાનો પ્રકાર | ખર્ચ (રૂ.લાખ) ૨૦૨૦-૨૧ |
|-------|-----------|---|--------------------------|-----------------------|
| ૧. | ૨૭૦૪-૨ | કે.વિ.કે., નવસારી | આઈ.સી.એ.આર. | ૧૧.૬૦ |
| ૨. | ૨૦૭૬-૧૮ | કે.વિ.કે. રીવોલ્વિંગ ફંડ એકાઉન્ટ | કે.વિ.કે. રીવોલ્વિંગ ફંડ | ૭.૫૦ |
| ૩. | ૧૨૩૦૬-એ | એડોપ્ટીવ ટ્રાયલ | પ્લાન યોજના | ૮.૮૮ |
| ૪. | ૧૨૮૪૪ | એસ્ટાભ્લીશમેન્ટ ઓફ ડેમોનસ્ટ્રેશન કમ ટ્રેનીંગ સેન્ટર ઈન ઈનલેન્ડ એક્વાક્લ્યુર | પ્લાન યોજના | ૨૩.૦૪ |
| ૫. | ૨૭૦૪-૨-એ | સીડ હબ યોજના | આઈ.સી.એ.આર. | ૨૬.૧૧ |
| ૬. | ૨૧૦૫-૦૦ | કઠોળ પાકના કલસ્ટર એફ.એલ.ડી. એન.એફ.એસ.એમ પુરસ્કૃત યોજના | આઈ.સી.એ.આર. | ૨.૫૦ |
| ૭. | ૨૦૬૮- સી | કેવિકે નવસારી આઈ.સી.એ.આર. યોજના | આઈ.સી.એ.આર. | ૦.૧૮ |
| ૮. | ૧૮૧૭૨-૦૨ | ડેવલોપમેન્ટ ડેમોનસ્ટ્રેશન એન્ડ અવરનેશ પ્રોગ્રામ ઓફ ઓર્ગેનિક ફાર્મિંગ ઈન સાઉથ ગુજરાત રીજીયન | અધર એજન્સી | ૩૬.૪૨ |
| ૯. | ૧૮૬૩૦- બી | ટર્મીયિક કેવિકે નવસારી | અધર એજન્સી | ૦.૪૫ |
| ૧૦. | ૧૮૧૦૩ | મહિન્દ્રા સમૃદ્ધિ એવોર્ડ | અધર એજન્સી | ૦.૧૩ |
| ૧૧. | ૧૮૧૮૧ | આર્થિક પ્રોજેક્ટ | અધર એજન્સી | ૫.૭૮ |
| ૧૨. | ૨૧૨૫/૦૨ | પીકેવીવાય | અધર એજન્સી | ૨.૬૦ |
| ૧૩. | ૨૧૩૨/૦૩ | Microbial based agri wasterment using vermicomposting under (SAP) | અધર એજન્સી | ૦.૨૧ |

મુદ્દા નંબર :— ૧૨ ફાળવેલ રકમો સહિત સબસિડી કાર્યક્રમોની અમલ બજવણીની રીત અને એવા કાર્યક્રમોના લાભાર્થીઓની વિગતો :—

આર્થિક સહાય આપવામાં આવતી નથી. પરંતુ FLD અંતર્ગત ઈનપુટ્સ આપવામાં આવે છે.

મુદ્દા નંબર :— ૧૩ તેણો આપેલ છુટછાટો, પરવાનગીઓ અથવા અધિકૃતિઓ મેળવનારાની વિગતો :—

લાગુ પડતું નથી.

મુદ્દા નંબર :— ૧૪ ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં તેને ઉપલબ્ધ અથવા તેની પાસેની માહિતીને લગતી વિગતો :—

નવસારી કૃષિ યુનિવર્સિટીની વેબસાઈટ www.nau.in પર માહિતી મુકેલ છે.

મુદ્દા નંબર :— ૧૫ જાહેર ઉપયોગ માટે નિભાવવામાં આવતા હોય, તો તેવા ગ્રંથાલય અથવા તેના વાંચન કક્ષાના કામકાજના કલાકો સહિતની માહિતી મેળવવા માટે નાગરિકોને ઉપલબ્ધ સુવિધાઓની વિગતો :—

અતેની કચેરી ખાતે જાહેર ઉપયોગ હેતુ નાગરીકો માટે ઉપલબ્ધ નથી.

મુદ્દા નંબર :— ૧૬ જાહેર માહિતી અધિકારીઓના નામો, હોદાઓ અને બીજી વિગતો

| | |
|--|--|
| ડૉ. સી. કે. ટીબડીયા | |
| વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી, પીન નં. ૩૮૬ ૪૫૦ | |
| ટેલીફોન નંબર | |
| ઓફિસ | ૦૨૬૩૭ ૨૮૨૦૦૮, ૨૮૨૦૦૯ |
| મોબાઇલ | ૦૯૭૨૫૦૦૬૦૧૨ |
| રહેઠાણ | ૯૮૨૫૩૮૬૪૩૫ |
| ફેક્સ | ૦૨૬૩૭ ૨૮૨૦૦૯ |
| E-mail | kvknavsari@nau.in kvknavsari@yahoo.com |

મુદ્દા નંબર :— ૧૭ ઠરાવવામાં આવે તેવી બીજી માહિતી; પ્રસિદ્ધ કરવી જોઈશો અને ત્યારપદ્ધી દર વર્ષ આ પ્રકાશનોને અધ્યાવત કરવા જોઈએ :— હા

GJ. m/s
જાહેર માહિતી અધિકારી અને
વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા,
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,

ઓનેક્શર-બી

(સામાન્ય વહીવટ વિભાગના તા.૦૧-૫-૦૮ ના પરિપત્ર ક્રમાંક:પીએડી-૧૦-૨૦૦૭-૩૩૫૩૬૪
આરટીઆઈ સેલનું બિડાણ)

પ્રમાણપત્ર

આથી પ્રમાણિત કરવામાં આવે છે કે, માહિતી અધિકાર અધિનિયમની કલમ-૪ અંતર્ગત સ્વયં જાહેર
કરવાની બાબતો પ્રોએક્ટીવ ડીસ્કલોઝર (P.A.D.) મારા વિભાગ દ્વારા કરવામાં આવેલ છે.
તા.૦૧/૦૫/૨૦૨૦ની સ્થિતિએ અમારી મંજૂરી મેળવી અધિતન કરવામાં આવેલ છે.

તા. ૧૨/૦૫/૨૦૨૧

G.T. Patel
જાહેર માહિતી અધિકારી
અને
વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર
નવસારી કૃષિ યુનિવર્સિટી
નવસારી

G.T. Patel
અપાલ લંટા દિવાની
અને
વિશ્વરાસ કાલ વિચારણ
નવસારી કૃષિ યુનિવર્સિટી